

જોધ, ભય અને એકલતાની લાગણી
તમને નીચમનું ભંગ કરવા માટે પ્રેરી શકે છે.



એને જ પરિક્ષણ કહેવાય છે. પ્રાર્થના કરો, કે
પ્રભુ તમને તમારી લાગણીઓમાં સહાય કરે